



Faizane Yasin Sharif (Gujarati)

# ફૈઝાને યાસીન શરીફ

મઝા

દુઆએ નિસ્ફે શા'બાનુલ મુઅઝ્ઝમ



MC 1286



## “ફેઝાને યાસીન શરીફ”

યેહ રિસાલા (ફેઝાને યાસીન શરીફ)

મજલિસે અલ મદીનતુલ ઇલ્મિય્યા (દા'વતે ઇસ્લામી) ને ઉર્દૂ ઝબાન મેં પેશ કિયા હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઇસ્લામી) ને ઇસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઓર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા હૈ. ઇસ મેં અગર કિસી જગહ કમી બેશી પાએં તો મજલિસે તરાજિમ કો (બઝરીઅએ મક્તૂબ, ઇ-મેઇલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

રાબિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઇસ્લામી)

**મક-ત-બતુલ મદીના**

સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મસ્જિદ કે સામને, તીન દરવાઝા,  
અહમદઆબાદ-1, ગુજરાત, ઇન્ડિયા **MO. 9374031409**

E-mail : translationmaktabhind@dawateislami.net

## કિયામત કે રોઝ હસરત

ફરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : સબ સે ઝિયાદા હસરત કિયામત કે દિન ઉસ કો હોગી જિસે દુન્યા મેં ઇલ્મ હાસિલ કરને કા મૌકઅ મિલા મગર ઉસ ને હાસિલ ન કિયા ઓર ઉસ શાખ્સ કો હોગી જિસ ને ઇલ્મ હાસિલ કિયા ઓર દૂસરોં ને તો ઉસ સે સુન કર નફ્અ ઉઠાયા લેકિન ઇસ ને ન ઉઠાયા (યા'ની ઉસ ઇલ્મ પર અમલ ન કિયા).  
(તારિખ دمشق لابن عساکر ج ٥١ ص ١٣٨ ادارالفکر بیروت)

## કિતાબ કે ખરીદાર મુ-તવજ્જેહ હોં

કિતાબ કી તબાઅત મેં નુમાયાં ખરાબી હો યા સફહાત કમ હોં યા બાઈન્ડિંગ,  
મેં આગે પીછે હો ગએ હોં તો મક-ત-બતુલ મદીના સે રુજૂઅ ફરમાઈયે.

પેશકશ: મજલિસે અલ મદીનતુલ ઇલ્મિય્યા  
(દા'વતે ઇસ્લામી)

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ  
أَمَا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

## ફેઝાને યાસીન શરીફ

મઅ દુઆએ નિરફે શા'બાનુલ મુઅઝ્ઝમ

### દુરદે પાક કી ફઝીલત

ખા-તમુલ મુર-સલીન, રહ્મતુલ્લિલ  
આ-લમીન, શફીઉલ મુઝ્ઝિનબીન, અનીસુલ ગરીબીન,  
સિરાજુસ્સાલિકીન, મહબૂબે રબ્બુલ આ-લમીન, જનાબે  
સાદિકો અમીન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને દિલ  
નશીન હૈ : “જિસ ને કિતાબ મેં મુઝ પર દુરદે પાક લિખા  
તો જબ તક મેરા નામ ઉસ મેં રહેગા ફિરિશ્તે ઉસ કે લિયે  
ઈસ્તિઝ્ફાર (યા'ની દુઆએ મઘ્ફિરત) કરતે રહેંગે.”

(الْمُعْجَمُ الْأَوْسَطُ لِلطَّبْرَانِيِّ ج ١ ص ٤٩٧ حديث ١٨٣٠)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ عَلَى مُحَمَّدٍ

## સૂરએ યાસીન શરીફ કે ફઝાઈલ

﴿1﴾ હઝરતે સય્યિદુના મા'કિલ બિન યસાર رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ سے  
રિવાયત હૈ કે સરકારે વાલા તબાર, હમ બે કસોં કે મદદગાર,  
શફીએ રોઝે શુમાર, દો આલમ કે માલિકો મુખ્તાર, હબીબે  
પરવર દગાર صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ફરમાયા : સૂરએ  
યાસીન કુરઆન કા દિલ હૈ જો ઈસે અલ્લાહ હઝલ્ કી રિઝા

और आभिरत की बेहतरी के लिये पढेगा उस की मग्दिरत कर दी जायेगी.

(أَلْفَسَنَّةٌ لِلْإِمَامِ أَحْمَدَ بْنِ حَنْبَلٍ ج ٧ ص ٢٨٦ حديث ٢٠٣٢٢ ملقطاً)

﴿2﴾ उजरते सय्यिदुना अनस रضى الله تعالى عنه से रिवायत है के रसूले अकरम, नूरे मुजस्सम صلى الله تعالى عليه و آله و سلم ने फरमाया : बेशक हर चीज का अेक दिल् है और कुरआन का दिल् सूरअे यासीन है और जो अेक मर्तबा सूरअे यासीन पढेगा अद्लाह तआला उस के लिये दस मर्तबा कुरआन पढने का सवाब लिभेगा. (سُنَنِ التَّرْمِذِيِّ ج ٤ ص ٤٠٦ حديث ٢٨٩٦)

﴿3﴾ उजरते सय्यिदुना एंने अब्बास رضى الله تعالى عنهما से रिवायत है के नबिये अकरम, नूरे मुजस्सम, सरकारे दौ आलम صلى الله تعالى عليه و آله و سلم ने फरमाया : मेरी प्वाडिश है के सूरअे यासीन मेरी उम्मत के हर एन्सान के दिल् में हो.

(اتحاف الخيرة المهرة ج ٨ ص ١٨٢ حديث ٧٨٦٨)

﴿4﴾ उजरते सय्यिदुना अनस رضى الله تعالى عنه से रिवायत है के हुजुरे अकरम, रसूले मुह्तशम, शाहे बनी आदम के हुजुरे अकरम, रसूले मुह्तशम, शाहे बनी आदम صلى الله تعالى عليه و آله و سلم ने फरमाया : जो शप्स हमेशा हर रात सूरअे यासीन की तिलावत करता रहा फिर मर गया तो वोड शहीद भरेगा. (المعجم الاوسط للطبرانی ج ٥ ص ١٨٨ حديث ٧٠١٨)

﴿5﴾ उजरते सय्यिदुना अता बिन अबू रबाह से रिवायत है के शह-शाहे मदीना, सुइरे

કલબો સીના صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ઇશદિ ફરમાયા : જો શપ્સ દિન કી ઇબ્તિદા મેં સૂરએ યાસીન કી તિલાવત કરેગા, ઉસ કી હાજત પૂરી કર દી જાએંગી.

(سنن الدارمی ج ۲ ص ۵۴۹ حدیث ۳۴۱۸)

﴿6﴾ હઝરતે સય્યિદુના ઇબને અબ્બાસ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا ફરમાતે હેં : જો શપ્સ બ વક્તે સુબહ સૂરએ યાસીન કી તિલાવત કરે ઉસે શામ તક ઉસ દિન કી આસાની અતા કી ગઈ ઓર જિસ શપ્સ ને રાત કી ઇબ્તિદા મેં ઇસ કી તિલાવત કી ઉસે સુબહ તક ઉસ રાત કી આસાની દી ગઈ.

(سنن الدارمی ج ۲ ص ۵۴۹ حدیث ۳۴۱۹)

﴿7﴾ હઝરતે સય્યિદુના જાબિર બિન સમુરહ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ સે મરવી હૈ ફરમાતે હેં : હુઝૂરે પાક, સાહિબે લૌલાક સુબહ કે વક્ત સૂરએ યાસીન કી તિલાવત ફરમાયા કરતે થે.

(المعجم الاوسط للطبرانی ج ۳ ص ۷۳ حدیث ۳۹۰۳)

﴿8﴾ હઝરતે સય્યિદુના અબૂ કિલાબا رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ સે રિવાયત હૈ, વોહ ફરમાતે હેં : જિસ ને સૂરએ યાસીન કી તિલાવત કી ઉસ કી મઝિરત હો જાએંગી, જિસ ને ભૂક કે વક્ત પઢી વોહ સૈર હો જાએગા, જો રાસ્તા ભૂલ જાને કે વક્ત પઢે ઉસે રાસ્તા મિલ જાએગા, જો ગુમશુદા થીઝ કે લિયે પઢે ઉસે પા લેગા ઓર જિસ ને ખાને કે વક્ત ઉસ કે

કમ હોને કી હાલત મેં તિલાવત કી તો વોહ ઉસે કિફાયત કરેગા, જિસ ને કિસી મરને વાલે કે પાસ ઈસ કી તિલાવત કી ઉસ પર નરમી કી જાએગી, જિસ ને કિસી ઐસી ઔરત કે પાસ ઈસ કી તિલાવત કી જિસ પર બચ્ચે કી વિલાદત તંગ હો ઉસ પર આસાની હોગી ઔર જિસ ને ઈસ કી તિલાવત કી ગોયા કે ઉસ ને ગ્યારહ મર્તબા કુરઆને પાક કી તિલાવત કી ઔર હર ચીઝ કે લિયે દિલ હૈ ઔર કુરઆન કા દિલ સૂરએ યાસીન હૈ.

(شعب الايمان ج ٢ ص ٤٨١ حديث ٢٤٦٧ ملقطاً)

﴿9﴾ હઝરતે સય્યિદુના અબૂ જા'ફર મુહમ્મદ બિન અલી રَضِيَ اللهُ تَعَالَى عَنْهُ سے રિવાયત હૈ ફરમાતે હૈં : જો શખ્સ અપને દિલ મેં સખ્તી પાએ તો વોહ એક પિયાલે મેં ઝા'ફરાન સે “**لَيْسَ ۝ وَالْقُرْآنِ الْحَكِيمِ ۝**” લિખે ફિર ઉસે પી જાએ. (उस का दिल नर्म होगा)

(شعب الايمان ج ٢ ص ٤٨٢ حديث ٢٤٦٨)

﴿10﴾ હઝરતે સય્યિદુના અબૂ હુરૈરા رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ سے મરવી હૈ કે અલ્લાહ عَزَّ وَجَلَّ કે મહબૂબ, દાનાએ ગુયૂબ, મુનઝઝહુન અનિલ ઉયૂબ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ફરમાયા : જિસ ને અલ્લાહ તઆલા કી રિઝા પાને કે લિયે કિસી ભી શબ મેં સૂરએ યાસીન કી તિલાવત કી તો ઉસ કી મફિરત કર દી જાએગી. (حلية الاولياء ج ٢ ص ١٨١ حديث ١٨٠٩)

﴿ اٰبَاتَهَا ۸۳ ﴾ ﴿ ۳۶ سُورَةُ يُسُ ۳۱ ﴾ ﴿ رُكُوْعَاتُهَا ۵ ﴾

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

یُسُ ۱ وَالْقُرْآنِ الْحَکِیْمِ ۲ اِنَّكَ لَمِنَ

الْمُرْسَلِیْنَ ۳ عَلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۴

تَنْزِیْلِ الْعَزِیْزِ الرَّحِیْمِ ۵ لِتُنْذِرَ قَوْمًا

مَا اُنْذِرَ اٰبَاؤُهُمْ فَهُمْ غٰفِلُوْنَ ۶ لَقَدْ

حَقَّ الْقَوْلُ عَلٰی اَكْثَرِهِمْ فَهُمْ لَا یُؤْمِنُوْنَ ۷

اِنَّا جَعَلْنَا فِیْ اَعْنَاقِهِمْ اَغْلٰلًا فَهٰی اِلٰی

الْاَذْقَانِ فَهُمْ مُّقْمَحُوْنَ ۸ وَجَعَلْنَا مِنْ

بَیْنِ اَیْدِیْهِمْ سَدًّا وَّ مِنْ خَلْفِهِمْ سَدًّا

فَاَعْشٰی لَهُمْ فَهُمْ لَا یُبْصِرُوْنَ ۹ وَسَوَآءٌ

عَلَيْهِمْ ءَأَنْذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا

يُؤْمِنُونَ ۝۱۰ إِنَّمَا تُنذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ

وَخَشِيَ الرَّحْمَنَ الْغَيْبَ ۚ فَبَشِّرْهُ بِعَفْوَةٍ

وَ أَجْرٍ كَرِيمٍ ۝۱۱ إِنَّا نَحْنُ نُحْيِي الْمَوْتَىٰ

وَنَكْتُبُ مَا قَدَّمُوا وَآثَارَهُمْ ۖ وَكُلَّ

شَيْءٍ ءَأَحْصِينَهُ فِي إِمَامٍ مُّبِينٍ ۝۱۲ وَ

أَضْرِبْ لَهُمْ مَثَلًا أَصْحَابَ الْقَرْيَةِ ۖ إِذْ

جَاءَهَا الْمُرْسَلُونَ ۝۱۳ إِذْ أَرْسَلْنَا إِلَيْهِم

اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا

إِنَّا إِلَيْكُمْ مُّرْسَلُونَ ۝۱۴ قَالُوا مَا أَنْتُمْ إِلَّا

بَشَرٌ مِّثْلُنَا ۖ وَمَا أَنْزَلَ الرَّحْمَنُ مِنْ شَيْءٍ ۗ

وقف غفران

۱۲

وقف ابرار



إِنْ أَنْتُمْ إِلَّا تَكْذِبُونَ ﴿١٥﴾ قَالُوا رَبَّنَا عَلِّمْنَا

إِنَّا إِلَيْكُمْ لَمُرْسَلُونَ ﴿١٦﴾ وَمَا عَلَّمْنَا إِلَّا

الْبَدْعَ السَّيِّئُ ﴿١٧﴾ قَالُوا إِنَّا تَطَيَّرْنَا بِكُمْ

لَإِن لَّمْ تَنْتَهُوا لَنَرْجُمَنَّكُمْ وَلَيَسَّيَنَّ مِنَّا

عَذَابُ الْيَوْمِ ﴿١٨﴾ قَالُوا طَيَّرْنَاكُمْ مَعَكُمْ ط

ذُكِّرْتُمْ ط بَلْ أَنْتُمْ قَوْمٌ مُّسْرِفُونَ ﴿١٩﴾ وَجَاءَ

مِنْ أَقْصَا الْمَدْيَنَةِ رَجُلٌ يَّسْعَى قَالَ

يَقَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ ﴿٢٠﴾ اتَّبِعُوا مَنْ لَا

يَسْأَلُكُمْ أَجْرًا وَهُمْ مُّهْتَدُونَ ﴿٢١﴾ وَمَالِي

لَا أَعْبُدُ الذَّمِّي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ ﴿٢٢﴾

عَا تَتَّخِذُ مِنْ دُونِهَا إِلَهَةً إِنَّ يُرِيدُنِ الرَّحْمَنُ

بَصْرٍ لَا تُعْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا  
 يُنْقِدُونَ ﴿٢٣﴾ إِنِّي إِذًا لَفِي ضَلَالٍ مُّبِينٍ ﴿٢٣﴾  
 إِنِّي آمَنْتُ بِرَبِّكُمْ فَاسْمِعُونِ ﴿٢٥﴾ قِيلَ  
 ادْخُلِ الْجَنَّةَ ۗ قَالَ يَلِيَّتْ قَوْمِي  
 يَاعْلَمُونَ ﴿٢٦﴾ بِمَا عَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ  
 الْكَاذِبِينَ ﴿٢٧﴾ وَمَا أَنْزَلْنَا عَلَى قَوْمِهِ مِنْ  
 بَعْدِهِ مِنْ جُنْدٍ مِنَ السَّمَاءِ وَمَا كُنَّا  
 مُنْزِلِينَ ﴿٢٨﴾ إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً  
 فَإِذَا هُمْ خِدُودًا ﴿٢٩﴾ يُحْسِرَةٌ عَلَى الْعِبَادِ  
 مَا يَأْتِيهِمْ مِنْ رَسُولٍ إِلَّا كَانُوا بِهِ  
 يَسْتَهْزِءُونَ ﴿٣٠﴾ أَلَمْ يَرَوْا كَمَا أَهْلَكْنَا قَبْلَهُمْ

مِّنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا يَرْجِعُونَ ﴿٣١﴾ وَ

إِنْ كُلُّ لَبَّاسٍ لَّدِينَا مُحْضَرُونَ ﴿٣٢﴾ وَآيَةٌ

لَهُمْ الْأَرْضُ الْمَيْتَةُ ۖ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا

مِنْهَا حَبَّافِينَهُ يَأْكُلُونَ ﴿٣٣﴾ وَجَعَلْنَا فِيهَا

جَنَّتٍ مِّنْ نَّخِيلٍ وَأَعْنَابٍ وَفَجَّرْنَا فِيهَا

مِنَ الْعُيُونِ ۖ لِيَأْكُلُوا مِن ثَمَرِهِ ۚ وَمَا

عَمِلَتْهُ أَيْدِيهِمْ ۖ أَفَلَا يَشْكُرُونَ ﴿٣٥﴾ سُبْحَانَ

الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنْبِتُ

الْأَرْضُ وَمِنْ أَنفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُونَ ﴿٣٦﴾

وَآيَةٌ لَهُمُ اللَّيْلُ ۖ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُمْ

مُّظْلِمُونَ ﴿٣٧﴾ وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَّهَا ۖ

ذٰلِكَ تَقْدِيْرُ الْعَزِيْزِ الْعَلِيْمِ ﴿٣٨﴾ وَالْقَمَرَ  
 قَدَّرْنٰهُ مَنَازِلَ حَتّٰى عَادَ كَالْعُرْجُوْنِ  
 الْقَدِيْمِ ﴿٣٩﴾ لَا الشَّمْسُ يَنْبَغِيْ لَهَا اَنْ  
 تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ ۗ وَ  
 كُلٌّ فِيْ فَلَكٍ يَّسْبَحُوْنَ ﴿٤٠﴾ وَاٰيَةٌ لَهُمْ اَنْ اَحْمَلْنَا  
 ذُرِّيَّتَهُمْ فِي الْفُلِكِ الْمُسْحُوْنَ ﴿٤١﴾ وَخَلَقْنَا لَهُمْ  
 مِنْ مِّثْلِهٖ مَا يَرْكَبُوْنَ ﴿٤٢﴾ وَاِنْ نَّشَا نَعْرُقْهُمْ  
 فَلَا صَرِيْحَ لَهُمْ وَلَا هُمْ يُنْقَدُوْنَ ﴿٤٣﴾ اِلَّا  
 رَحْمَةً مِنَّا وَمَتَاعًا اِلَىٰ حِيْنٍ ﴿٤٤﴾ وَاِذَا  
 قِيْلَ لَهُمْ اتَّقُوا مَا بَيْنَ اَيْدِيْكُمْ وَمَا خَلْفَكُمْ  
 لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ﴿٤٥﴾ وَمَا تَاْتِيْهِمْ مِنْ اٰيَةٍ

مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ ﴿٣٦﴾

وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا رَزَقَكُمُ اللَّهُ

قَالَ الَّذِينَ كَفَرُوا وَاللَّذِينَ آمَنُوا أَتَطْعَمُ

مَنْ لَوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ ۗ إِنَّ أَنْتُمْ إِلَّا فِي

ضَلَالٍ مُّبِينٍ ﴿٣٧﴾ وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ

إِنْ كُنْتُمْ صَادِقِينَ ﴿٣٨﴾ مَا يَنْظُرُونَ إِلَّا صَيْحَةً

وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّصُونَ ﴿٣٩﴾ فَلَا

يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ

يَرْجِعُونَ ﴿٤٠﴾ وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُمْ مِنَ

الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنْسِلُونَ ﴿٤١﴾ قَالُوا

يُؤْيَلْنَا مِنْ بَعَثْنَا مِنْ مَّرْقَدِنَا ۗ هَذَا مَا

٣٦

٣٧

وَعَدَ الرَّحْمَنُ وَصَدَقَ الْبُرْسُلُونَ ﴿٥٢﴾ إِنَّ

كَانَتْ إِلَّا صَيِّحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَبِيحٌ

لَدَيْنَا مَحْضُرُونَ ﴿٥٣﴾ فَالْيَوْمَ لَا تُظَلَمُ نَفْسٌ

شَيْئًا وَلَا تَجْزُونَ إِلَّا مَا كُنْتُمْ تَعْمَلُونَ ﴿٥٤﴾

إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغْلٍ فَاكِهِونَ ﴿٥٥﴾

هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلِّ عَلَى الْأَسْرَابِكِ

مُتَّكِئُونَ ﴿٥٦﴾ لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُمْ مَا

يَدَّعُونَ ﴿٥٧﴾ سَلَامٌ قَوْلًا مِّن رَّبِّ رَاحِمٍ ﴿٥٨﴾

وَأَمَّا ذُو الْيَوْمِ أَيُّهَا الْمُجْرِمُونَ ﴿٥٩﴾ أَلَمْ

أَعْهَدَ إِلَيْكُمْ بِبَنِي آدَمَ أَنْ لَا تَعْبُدُوا

الشَّيْطَانَ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ﴿٦٠﴾ وَأَنَّ

وقف غفران

اعْبُدُونِي ۚ هَذَا صِرَاطٌ مُسْتَقِيمٌ ﴿٢١﴾ وَلَقَدْ

أَضَلَّ مِنْكُمْ جِجَالًا كَثِيرًا ۖ أَقَلَّمْ تَكُونُوا

تَعْقِلُونَ ﴿٢٢﴾ هَذِهِ جَهَنَّمُ الَّتِي كُنْتُمْ

تُوعَدُونَ ﴿٢٣﴾ إِصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنْتُمْ

تَكْفُرُونَ ﴿٢٤﴾ الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَ

تُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ أَرْجُلُهُمْ بِمَا كَانُوا

يَكْسِبُونَ ﴿٢٥﴾ وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ

فَأَسْتَبَقُوا الصِّرَاطَ فَأَنَّى يُبْصَرُونَ ﴿٢٦﴾ وَلَوْ

نَشَاءُ لَسَخَّطْنَاهُمْ عَلَىٰ مَا كَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا

مُضِيًّا وَلَا يَرْجِعُونَ ﴿٢٧﴾ وَمَنْ تُعَرِّهْ نُكُوسُهُ

فِي الْخَلْقِ ۖ أَفَلَا يَعْقِلُونَ ﴿٢٨﴾ وَمَا عَلَّمْنَاهُ

﴿٢٨﴾

الشَّعْرَ وَمَا يَنْبَغِي لَهُ ۗ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَّ  
 قُرْآنٌ مُّبِينٌ ﴿١٩﴾ لِيُذِكرَ مَنْ كَانَ حَيًّا وَّ  
 يَحِقَّ الْقَوْلُ عَلَى الْكٰفِرِينَ ﴿٢٠﴾ أَوْلَمْ يَرَوْا  
 أَنَّا خَلَقْنَا لَهُمْ مِمَّا عَمِلَتْ أَيْدِينَا أَنْعَامًا  
 فَهُمْ لَهَا مٰلِكُونَ ﴿٢١﴾ وَذَلَّلْنَا لَهُمْ فِئْمَهَا  
 رَاكِبِينَ وَمِنْهَا يَأْكُلُونَ ﴿٢٢﴾ وَلَهُمْ فِيهَا  
 مَنَافِعُ وَمَشَارِبٌ ۗ أَفَلَا يَشْكُرُونَ ﴿٢٣﴾ وَاتَّخَذُوا  
 مِنْ دُونِ اللَّهِ إِلَهَةً لَعَلَّهُمْ يُبْصِرُونَ ﴿٢٤﴾ لَا  
 يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُنْدٌ مُّحْضَرُونَ ﴿٢٥﴾  
 فَلَا يَحْزُنكَ قَوْلُهُمْ ۗ إِنَّا نَعْلَمُ مَا يُسْرُونَ وَمَا  
 يُعْلِنُونَ ﴿٢٦﴾ أَوْلَمْ يَرَ الْإِنْسَانُ أَنَّا خَلَقْنَاهُ مِنْ



تُطْفَةٌ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ ﴿٤٤﴾ وَضَرَبَ لَنَا  
 مَثَلًا وَنَسِيَ خَلْقَهُ ۖ قَالَ مَنْ يُحْيِي الْعِظَامَ وَ  
 هِيَ رَمِيمٌ ﴿٤٥﴾ قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ  
 مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ ﴿٤٦﴾ الَّذِي جَعَلَ  
 لَكُمْ مِنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا آنْتُمْ  
 مِنْهُ تُوقَدُونَ ﴿٤٧﴾ أَوَلَيْسَ الَّذِي خَلَقَ  
 السَّمَوَاتِ وَالْأَرْضَ بِقَدِيرٍ عَلَىٰ أَنْ يَخْلُقَ  
 مِثْلَهُمْ ۚ بَلَىٰ ۖ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ ﴿٤٨﴾ إِنَّمَا  
 أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَنْ يَقُولَ لَهُ كُنْ  
 فَيَكُونُ ﴿٤٩﴾ فَسُبْحَانَ الَّذِي بِيَدِهِ مَلَكُوتُ  
 كُلِّ شَيْءٍ ۖ وَإِلَيْهِ تُرْجَعُونَ ﴿٥٠﴾

મગરિબ કે બા'દ છ નવાફિલ

મા'મૂલાતે ઔલિયાએ કિરામ رَحْمَةُ اللهِ السَّلَام سے હૈ કે મગરિબ કે ફર્જ વ સુન્નત વગૈરા કે બા'દ છ રક્અત નફલ દો દો રક્અત કર કે અદા કિયે જાએ. પહલી દો રક્અતોં સે પહલે યેહ નિચ્ચત કીજિયે : “યા અલ્લાહ جَلَّ وَعَزَّ ةن દો રક્અતોં કી બ-ર-કત સે મુઝે દરાજિયે ઉમ્ર બિલખૈર અતા ફરમા.” દૂસરી દો રક્અતોં મેં યેહ નિચ્ચત ફરમાઈયે : “યા અલ્લાહ جَلَّ وَعَزَّ ةن દો રક્અતોં કી બ-ર-કત સે બલાઓં સે મેરી હિફાઝત ફરમા.” તીસરી દો રક્અતોં કે લિયે યેહ નિચ્ચત કીજિયે : “યા અલ્લાહ جَلَّ وَعَزَّ ةن દો રક્અતોં કી બ-ર-કત સે મુઝે અપને સિવા કિસી કા મોહતાજ ન કર.” ઈન 6 રક્અતોં મેં સૂ-રતુલ ફાતિહા કે બા'દ જો યાહેં વોહ સૂરતેં પઢ સકતે હેં, બેહતર યેહ હૈ કે હર રક્અત મેં સૂ-રતુલ ફાતિહા કે બા'દ તીન તીન બાર સૂ-રતુલ ઈખ્લાસ પઢ લીજિયે. હર દો રક્અત કે બા'દ ઈક્કીસ<sup>21</sup> બાર قُلْ هُوَ اللهُ أَحَدٌ (પૂરી સૂરત) યા એક બાર સૂરએ યાસીન શરીફ પઢિયે બલ્કે હો સકે તો દોનોં હી પઢ લીજિયે. યેહ ભી હો સકતા હૈ કે કોઈ એક ઈસ્લામી ભાઈ બુલન્દ આવાઝ સે યાસીન શરીફ પઢેં ઓર દૂસરે ખામોશી સે ખૂબ કાન લગા કર સુને. ઈસ મેં યેહ ખયાલ રહે કે દૂસરા ઈસ દૌરાન ઝબાન સે યાસીન શરીફ બલ્કે કુછ ભી ન પઢે ઓર યેહ મસ્બલા ખૂબ યાદ રખિયે કે જબ કુરઆને કરીમ બુલન્દ આવાઝ સે પઢા જાએ તો જો લોગ સુનને કે લિયે હાઝિર હૈં ઉન પર ફર્જે એન હૈં કે ચુપચાપ ખૂબ કાન લગા કર સુને. رَا تِ شُرْأَ لَهِ رَا تِ شُرْأَ لَهِ رَا تِ شُرْأَ لَهِ રાત શુરૂઅ હોતે હી સવાબ કા અમ્બાર લગ જાએગા. હર બાર યાસીન શરીફ કે બા'દ “દુઆએ નિસ્ફે શા'બાન” ભી પઢિયે.

દુઆએ નિસ્ફે શા'બાનુલ મુઅઝ્ઝમ

اَللّٰهُمَّ يَا ذَا الْجَلَالِ وَالْاِكْرَامِ ط  
اَللّٰهُمَّ يَا ذَا الطُّوْلِ وَالْاِنْعَامِ ط  
اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط  
اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط  
اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط  
اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط  
اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط  
اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط

اَللّٰهُمَّ يَا ذَا الْجَلَالِ وَالْاِكْرَامِ ط

اَللّٰهُمَّ يَا ذَا الطُّوْلِ وَالْاِنْعَامِ ط

اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط

اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط

اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط

اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط

اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط

اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط

اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط

اَللّٰهُمَّ يَا ذَا الْاِيْمَانِ وَالْاِيْمَانِ ط

بِالتَّجَلِّيِ الْأَعْظَمِ ط فِي كَيْلَةِ النِّصْفِ مِنْ شَهْرِ شَعْبَانَ

الْبُكْرَةِ ط الَّتِي يُفْرَقُ فِيهَا كُلُّ أَمْرٍ حَكِيمٍ وَيُبْرَمُ ط أَنْ

تَكْشَفَ عَنَّا مِنَ الْبَلَاءِ وَالْبُلُوَاءِ مَا نَعْلَمُ وَمَا لَا نَعْلَمُ ط

وَأَنْتَ بِهِ أَعْلَمُ ط إِنَّكَ أَنْتَ الْأَعَزُّ الْأَكْرَمُ ط وَصَلَّى اللَّهُ

تَعَالَى عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ وَسَلَّمَ ط

○ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ○

ऐ अल्लाह जल्ल जल्ल! ऐ अहसान करने वाले के जिस पर अहसान नहीं किया जाता! ऐ बड़ी शानो शौकत वाले! ऐ इजबो इन्आम वाले! तेरे सिवा कोई मा'बूद नहीं। तू परेशान हावों का मद्दगार, पनाह मांगने वालों को पनाह और भौंझड़ों को अमान देने वाला है। ऐ अल्लाह जल्ल जल्ल! अगर तू अपने यहां उम्मुल किताब (या'नी लौहे मलइज़) में मुझे शकी (या'नी बद बप्त), मलइम, धुत्कारा हुवा और रिज़क में तंगी दिया हुवा लिख चुका हो तो ऐ अल्लाह जल्ल जल्ल! अपने इज़ल से मेरी बद बप्ती, मलइमी, जिल्लत और रिज़क की तंगी को मिटा दे और अपने पास उम्मुल किताब में मुझे पुश बप्त, (कुशादा) रिज़क दिया हुवा और बलाइयों की तौड़ीक दिया हुवा सप्त (तहरीर) इरमा दे, के तू ने ही तेरी

નાઝિલ કી હુઈ કિતાબ મેં તેરે હી ભેજે હુએ નબી  
 صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી ઝબાને ફેઝ તરજુમાન પર ફરમાયા  
 ઓર તેરા (યેહ) ફરમાના હક હૈ : “તર-જ-મએ કન્ઝુલ ઈમાન :  
 અલ્લાહ જો યાહે મિટાતા હૈ ઓર સાબિત કરતા હૈ ઓર અસ્લ લિખા  
 હુવા ઉસી કે પાસ હૈ.” (૩૧: ૧૩૫) ખુદાયા عَزَّ وَجَلَّ તજલિયે  
 આ'ઝમ કે વસીલે સે જો નિસ્કે શા'બાનુલ મુકર્રમ કી રાત (યા'ની  
 શબે બરાઅત) મેં હૈ કે જિસ મેં બાંટ દિયા જાતા હૈ હર હિકમત વાલા  
 કામ ઓર અટલ કર દિયા જાતા હૈ. (યા અલ્લાહ!) આફતોં કો હમ  
 સે દૂર ફરમા કે જિન્હેં હમ જાનતે ઓર નહીં ભી જાનતે જબ કે તૂ ઉન્હેં  
 સબ સે ઝિયાદા જાનને વાલા હૈ. બેશક તૂ સબ સે બઢ કર અઝીઝ ઓર  
 ઈઝ્ઝત વાલા હૈ. અલ્લાહ તઆલા હમારે સરદાર મુહમ્મદ  
 صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર ઓર આપ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ  
 આલ વ અસ્લાબ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمْ પર દુરુદો સલામ ભેજે. સબ ખૂબિયાં  
 સબ જહાનોં કે પાલને વાલે અલ્લાહ عَزَّ وَجَلَّ કે લિયે હૈં.

### શુમાતત કી તા'રીફ

દૂસરોં કી તક્લીફોં ઓર મુસીબતોં પર ખુશી  
 કા ઈઝહાર કરને કો શુમાતત કહતે હૈં.

(حدیقه ندیه شرح طریقه محمدیه ج ۱ ص ۱۲۱)

### યુગલી કી તા'રીફ

કિસી કી બાત ઝરર (યા'ની નુક્સાન) પહોંચાને  
 કે ઈરાદે સે દૂસરોં કો પહોંચાના યુગલી હૈ.

(عمدة القاری ج ۲ ص ۵۹۴ تحت الحدیث ۲۱۶ دار الفکر بیروت)



الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ  
وَأَقْرَبِهِ كَمَا تَوْكَلْنَا بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِشِيرَانِ الْوَكُوفِينَ الرَّجِيمِ

## सुन्नत की जहारें

سُبْحَانَكَ اللَّهُمَّ تَعَالَى لِي دُرِّمَانِي سُبْحَانَكَ كِي आलमगीर गैर सिपाही तहरीक दा'वते  
ईस्लामी के माउके माउके म-दनी मातोल में अ कसरत सुन्नतें सीभी और सिपाही जाती हैं, हर  
जुमा'रात ईशा की नमाज के बाद आप के सहर में होने वाले दा'वते ईस्लामी के सफलावार  
सुन्नतों परे ईजतिमाअ में दिखाने ईस्लामी के खिये अखरी अखरी निष्पत्तों के साथ सारी रात  
गुजारने की म-दनी ईजतिअ है. आसिकाने रसूल के म-दनी काफिलों में अ निष्पत्ते सवाल  
सुन्नतों की तरबिप्पत के खिये सहर और रोजाना किंके मदीना के जरीये म-दनी ईन्आमात का  
रिखावा पुर कर के हर म-दनी माउ के ईन्निदाई इस दिन के अन्दर अन्दर अपने यहाँ के  
जिम्मेदार को जम्म करवाने का मा'मूल बना लीजिये, سُبْحَانَكَ اللَّهُمَّ تَعَالَى इस की अ-र-उत से पाबन्द  
सुन्नत बनने, गुनाहों से नकरत करने और ईमान की सिफाजत के खिये कुदने का जेहून बनना.  
हर ईस्लामी भाई अपना येत जेहून बनाने के "मुझे अपनी और सारी दु-या के  
दोगों की ईस्वाह की कोशिस करनी है. سُبْحَانَكَ اللَّهُمَّ تَعَالَى" अपनी ईस्वाह की कोशिस के खिये  
"म-दनी ईन्आमात" पर अमल और सारी दु-या के दोगों की ईस्वाह की कोशिस के खिये  
"म-दनी काफिलों" में सहर करना है. سُبْحَانَكَ اللَّهُمَّ تَعَالَى

### अड-त-जतुल मदीना की गाणें

सुरत : वलिधाभाई मस्जिद, ज्वाअर दाना दरगाह के पास. 9898615071

जामनगर : पांच डाटरी, 9327977293

मोडासा : सुका अजर, 9725824820

गांधीधाम : सपना नगर, मदीना मस्जिद के पास, 8141474279

धोलका : ताजदारे मदीना मस्जिद के सामने, टावर बाजार, 9374915797

### अड-त-जतुल मदीना

दा'वते ईस्लामी

مكتبة الدار

सिलेडेट्स हाँस, सविह की मस्जिद के सामने, तीन दरवाजा, अडमदअहमद-1 गुजरात, इन्डिया  
Mo.091 93271 68200 E-mail:maktabaahmedabad@gmail.com www.dawateislami.net